

જાહેર ખબર

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,
નિયામક, વિકસતી જાતિ કલ્યાણ,
બ્લોક નં.૪, ત્રીજો માળ, ડૉ.જીવરાજ મહેતા ભવન,ગાંધીનગર.
માનવ ગરીમા યોજના (વર્ષ ૨૦૨૧-૨૨)

નિયામક, વિકસતી જાતિ કલ્યાણની કચેરી, ગાંધીનગર દ્વારા માનવ ગરીમા યોજના હેઠળ રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી-વિમુક્ત જાતિઓના લાભાર્થીઓને સાધનો/ટુલ કીટ્સ પુરા પાડી સ્વરોજગારી આપવાની યોજના અમલમાં છે. જેમાં જુદા-જુદા ધંધાઓ/વ્યવસાયો માટે નિયમોનુસાર સાધનો/ટુલ કીટ્સ આપવામાં આવનાર છે.

સદરહું યોજના હેઠળ લાભ મેળવવા ઇચ્છતા અને સરકારશ્રીએ ઠરાવેલ માપદંડોની પાત્રતા ધરાવતા અરજદારઓ પાસેથી esamajkalyan.gujarat.gov.in પર તા.૧૨/૦૭/૨૦૨૧ થી તા. ૩૧/૦૭/૨૦૨૧ સુધી ઓનલાઇનથી અરજીઓ મંગાવવામાં આવે છે.

- (૧) માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઇન જ કરવાની રહેશે. અરજી સાથેના જરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઇન અપલોડ કરવાના રહેશે. અધુરી મળેલ અરજી દફતરે કરવામાં આવશે.
- (૨) અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ હોવી જોઈએ નહીં.
- (૩) વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહીં.
- (૪) અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- (૫) અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા, એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહિ.
- (૬) આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે.
- (૭) જિલ્લા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા જરૂરી જણાય તો ચકાસણી અર્થે ઓરીઝનલ ડોક્યુમેન્ટ માગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે.
- (૮) વર્ષ ૨૦૨૦-૨૧માં અરજી કરેલ હોય અને તે ડ્રોમાં પસંદ થયેલ ન હોય તો નવેસરથી ફરી અરજી કરી શકાશે.
- (૯) જે તે વ્યવસાય માટેની સરકાર માન્ય તાલીમ લીધેલ હોય તેવા અરજદારોને અગ્રતા આપવામાં આવશે.
- (૧૦) માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો esamajkalyan.gujarat.gov.in પર દર્શાવેલ છે. જેનો સંપૂર્ણ અભ્યાસ કરી અરજદારએ ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેમજ વિશેષ માહિતી જિલ્લાના નાયબ નિયામકશ્રી/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી,(વિકસતી જાતિ) ની કચેરીમાંથી પણ મળી રહેશે.
- (૧૧) માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.

સહી/-

(એન.એ.નિનામા IAS)

નિયામક

વિકસતી જાતિ કલ્યાણ

ગુજરાત રાજ્ય, ગાંધીનગર

સ્થળ:- ગાંધીનગર

તા:- ૦૯/૦૭/૨૦૨૧

નિયામક વિકસતી જાતિ કલ્યાણ ખાતા દ્વારા અમલીત માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા માટેના માપદંડ

- (૧) માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા માટેની અરજી ઓનલાઇનથી જ કરવાની રહેશે. અરજી સાથેનાજરૂરી ડોક્યુમેન્ટ પણ ઓનલાઇનથી અપલોડ કરવાના રહેશે. તથા અધુરી મળેલ અરજી નામંજૂર (૨૬) ગણાશે.
- (૨) અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- થી વધુ હોવી જોઈએ નહીં.
- (૩) વિચરતી વિમુક્ત જાતિ તેમજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ પૈકી અતિ પછાત જાતિ માટે આવક મર્યાદાનું ધોરણ લાગુ પડશે નહીં.
- (૪) અરજદારની ઉંમર જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહીં અને ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઈએ.
- (૫) અગાઉના વર્ષોમાં અરજદાર કે તેમના કુટુંબના સભ્યોએ આ ખાતા દ્વારા કે ગુજરાત રાજ્યના અન્ય ખાતા એજન્સી કે સંસ્થામાંથી આ પ્રકારની સહાય મેળવેલ હોવી જોઈએ નહિ.
- (૬) એક મોબાઇલ નંબર પરથી એક જ અરજી કરવાની રહેશે.
- (૭) જિલ્લા નાયબ નિયામક/જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, (વિકસતી જાતિ) દ્વારા અરજીમાં પુર્તતા કરવા જણાવવામાં આવે તો દિન-૧૫માં અરજદારએ પુર્તતા કરવાની રહેશે. ત્યાર બાદ મળેલ અરજી રદ ગણાશે.
- (૮) ઓનલાઇન કરેલ અરજીનું સ્ટેટસ જાણવા વેબસાઇટ જોતા રહેવું.
- (૯) માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા અંગેની વિગતો esamajkalyan.gujarat.gov.in પર જિલ્લાના નાયબ નિયામકશ્રી/ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી, (વિકસતી જાતિ) ની કચેરીમાંથી પણ મળી રહેશે.
- (૧૦) આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક જ વ્યક્તિને એક જ વાર મળવાપાત્ર છે.
- (૧૧) જિલ્લા કચેરીના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્વારા જરૂરી જણાય તો ચકાસણી અર્થ ઓરીઝનલ ડોક્યુમેન્ટ માગવામાં આવે ત્યારે બતાવવાના રહેશે. જેથી એક કુટુંબમાંથી એક કરતા વધારે અરજી કરેલ હોય તો તેવી અરજીઓ રદ ગણાશે.
- (૧૨) વર્ષ ૨૦૨૦-૨૧માં અરજી કરેલ હોય અને તે ડ્રોમાં પસંદ થયેલ ન હોય તો તેવા અરજદારોએ નવેસરથી ફરી અરજી કરી શકાશે.
- (૧૩) અરજદારએ જે તે વ્યવસાય માટેની સરકાર માન્ય તાલીમ લીધેલ હોય તેવા અરજદારને અગ્રતા આપવામાં આવશે.
- (૧૪) આ યોજનાનો લાભ અરજદારને ચાલુ વર્ષ લીધેલ/મળેલ ન હોય તો તે અરજદાર બીજા વર્ષ પુનઃ અરજી કરી શકે છે.
- (૧૫) અરજી મંજૂર/નામંજૂર કરવાની સત્તા જિલ્લા અધિકારીશ્રીની રહેશે. જે અંગે બીજો કોઈ હકદાવો કરી શકશે નહીં.
- (૧૬) ટુલ કિટ્સના લાભાર્થીએ નોટરાઇઝ સોગંદનામાથી નિયત કરેલ બાંહેધરી આપવાની રહેશે.
- (૧૭) માનવ ગરીમા યોજનામાં સહાય મેળવવા બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થશે તો નિયામક, વિકસતી જાતિ કલ્યાણ ખાતુ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરનો નિર્ણય આખરી રહેશે.
- (૧૮) ઘણા અરજદારો ઓનલાઇન અપલોડ કરવાના થતા ડોક્યુમેન્ટને બદલે કોરા કાગળ/લેખીત બાંહેધરીઓ અપલોડ કરતા હોય છે. તો આવી અરજીઓ ધ્યાને લીધા સિવાય દફતરે કરવામાં આવશે.
- (૧૯) જો લક્ષ્યાંક કરતા વધુ અરજીઓ મળશે તો નાણાકીય તથા ભૌતિક લક્ષ્યાંકની મર્યાદામાં અરજીઓ પસંદ કરવા માટે ઓનલાઇન કોમ્પ્યુટરાઇઝ ડ્રો કરવામાં આવશે, ડ્રોમાં પસંદ થયેલ અરજીઓને જ ટુલ કિટ્સઆપવામા આવશે બાકી રહેલ અરજીઓ દફતરે કરવામાં આવશે.આવા અરજદારો આગળના વર્ષમાં ફરી અરજી કરી શકશે.

સહી/-
(એન.એ.નિનામા IAS)
નિયામક
વિકસતી જાતિ કલ્યાણ
ગુજરાત રાજ્ય, ગાંધીનગર